

# મુસ્લિમ પર્સનલ લો

હજ. મવ. મુફતી આહમદ ખાનપુરી સા. દા.બ.  
શૈખુલ હદીસ, જમિઆહ ઇસ્લામિકયાહ, ડાનેલ.

## પ્રકાશક

જમિઆહ ઉત્તમુલ કુઆન જંબુસર  
મુ.પો. જંબુસર. જિ.ભરૂચ. ગુજરાત

---

# મુસ્લિમ પર્સનાલ લો

ઇં. મવ. મુફતી અહમદ ખાનપુરી સા. એ.બી.  
શૈલ્પિક છદ્રીસ, જામિયાન ઇસ્લામિકાન, ડાભેલ.

## પ્રકાશક

જામિયાન ઉલ્લમુલ કુઆન જંબુસર  
મુ.પો. જંબુસર. જિ.ભરૂચ. ગુજરાત

---

## ● મુસ્લિમ પર્સિનાલ લો

- લેખક : હાજર. મવ. મુફ્તી અહમદ ખાનપુરી સા. દા.બ.  
શૈખુલ હદ્દીસ, જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલ.
  - પ્રકાશન : ઓક્ટોબર, ૨૦૧૬.
  - પ્રત : ૧૦૦૦, બીજી આવૃત્તિ.
  - પ્રકાશક: મુફ્તી અહમદ દેવલ્વી  
મોહત્તમિમ, જામિઅહ ઉલૂમુલ કુર્ચાન જંબુસર  
મુ. પો. જંબુસર. જિ. ભરૂચ. ગુજરાત.  
પીન કોડ : ૩૮૨૧૫૦
- e mail : jamiahjambusar@gmail.com
-

## અનુક્રમણિકા

પ્રકાશકીય	
મુસ્લિમ પર્સનલ લો	
મુસ્લિમ પર્સનલ લોનું મહત્વ	
પર્સનલ લો, સમાજના અસ્તિત્વની બુનિયાદ છે.	
પર્સનલ લો, સમાજની ઓળખ હોય છે.	
પર્સનલ લો ખતમ થવાના દુષ્પરિણામો.	
આજાદ ભારતનું બંધારણ અને પર્સનલ લો	
કાયદાની ભૂલ ભૂલામણી.	
એક ચેતવણી.	
સમાન સિવિલમાં કોડ માટે સરકારી વલણ.	
મુસ્લિમોની લાગણીનું ડિડક	
હિન્દુ કૌમવાદી તત્ત્વો સરકારની વારે.	
હવે આપણે શું કરવું જોઈએ ?	

## પ્રકાશકીય

મુસલમાનોને લગતી એવી કોટું બિક બાબતો જેમાં એમને ઈસ્લામ તરફથી વિશેષ અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને વિગતવાર આદેશો અને હુકમો બતાવવામાં આવ્યા છે, એવી, અને કાયદાની ભાષામાં કહીએ તો દીવાની અદાલતને લગતી અમુક બાબતોને 'મુસ્લિમ પર્સનલ લો' કહેવામાં આવે છે. ભારતીય બંધારણ અને નાગરિક કાનૂનના અનુસંધાનમાં એનું વર્તૂળ ઓર વધારે સિમિત છે. એટલે કે સઘણા ઈસ્લામી ફોજદારી, દીવાની કાયદાઓ અને અદાલતી વ્યવસ્થા ખતમ કર્યા પછી નિકાષ, મહેર, તલાક, ખુલાય, વારસા વહેંચણી, વસીયત, બખ્શશા, જેવી ફક્ત ૧૫ પ્રકારની બાબતોને લગતા જે અમુક ઈસ્લામી હુકમોને ૧૮૮૮માં અંગ્રેજો દ્વારા 'મુસ્લિમ પર્સનલ લો' તરીકે માન્ય રાખવામાં આવ્યા, અને જ આજની ભારતીય પરિભાષામાં મુસ્લિમ પર્સનલ લો કહેવામાં આવે છે. રીતી રિવાજો અને સામાજિક વહેવારોના લગતા કાયદાઓ આધારિત અન્ય ધર્મના પર્સનલ લોમાં પણ ભારતીય કાયદામાં અસ્તિત્વ ધરાવે છે, એ પણ બધાએ

---

## જ્ઞાણવું જોઈએ.

આ પર્સનલ લોના આધારે ભારતમાં મુસલમાનોને એમની ઉપરોક્ત બાબતોમાં ધર્મ પ્રમાણે વર્તવાની છુટ છે. બીજો કોઈ કાયદો એમને લાગુ પડતો નથી. પણ બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોને બહાનું બનાવીને સમાન સિવિલ કોડના નામે મુસિલિમ પર્સનલ લોને ખતમ કરવાનું ઘડયંત્ર ઘણા પહેલાંથી ચાલતું આવે છે, મુસલમાનો પણ આ બાબતે ઘણી બધી ભૂલો કર્યા પછી કંઈક અંશે જગૃત થયા તો એમણે પર્સનલ લોના રક્ષણ અને ભારતીય કાયદામાં એના સ્થાનને ટકાવી રાખવા હેતુ કાનૂની અને જહેર રીતે પ્રયાસો શરૂ કર્યા. સામુહિક રીતે એકસંપે આવા પ્રયાસોની શરૂઆત ઢારૂલ ઉલ્લૂમ દેવબંદના મોહતમ્મિમ જનાબ મવલાના કારી તચ્ચિબ સાહેબ રહ. દ્વારા કરવામાં આવી. ૧૯૭૩ માં સહુપ્રથમ એમણે દેવબંદમાં એક મીટિંગ કરી, પછી મુંબઈમાં પોતાને મુસલમાનો કહેતા બધા જ ફિરકાના લોકોને સાથે રાખીને એક મીટિંગ થઈ, જેના થકી 'મુસિલિમ પર્સનલ લોને'ને લગતી બાબતોની કાનૂની લડાઈ લડવા 'મુસિલિમ પર્સનલ લોનો બોર્ડ' નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી.

આપના હથોમાં મોજૂદ આ પુસ્તિકામાં

આ બાબતેની વિગતવાર છણાવટ છે. ૧૯૮૫માં શાહબાનો કેસની લડાઈ વખતે જ્યારે પર્સનલ લોની ચર્ચાઓ જોરશોરથી ચાલતી હતી, ત્યારે હજરત અકદસ મવલાના મુફ્તી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.એ આ પુસ્તિકા સંપાદન ફરમાવી હતી. આપ સાહેબ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અસ્થાથી સભ્ય પણ છે. ૧૯૮૬ માં અમદાવાદ ખાતે પર્સનલ લો બોર્ડના રાષ્ટ્રીય અધિવેશનના આપ સાહેબના કન્વીનર હતા અને આપના પ્રયાસો અને માર્ગદર્શનથી જ આ અધિવેશન સફળ રહ્યું હતું.

આજે ફરીવાર જરૂરત ઉભી થઈ છે તો આ પુસ્તિકાને ફરીવાર અમે પ્રકાશિત કરી રહ્યા છીએ.

અલ્લાહ તાલા એને કુબૂલ ફરમાવે. વાચકોને એના થકી મુસ્લિમ પર્સનલ લો વિશે સાચી જાણકારી મળો અને મુસલમાનો પોતાના ઈસ્લામી કૌટંબિક કાયદાઓ અને હુકમો પ્રત્યે સભાન થઈને એ મુજબ અમલ કરે એવી દુઅા.

**મુફ્તી અહમદ દેવલ્લી.  
આમિયાહ જંબુસર.**

## મુસ્લિમ પર્સનલ લો

લો, એટલે કાનૂન જેના ઉપર ચાલવાથી જીવન સારી રીતે પસાર થાય અને પર્સનલ એટલે ખાનગી – વ્યક્તિગત. માટે 'પર્સનલ લો'નો અર્થ એવા ખાનગી કાયદાઓ જેના ઉપર ચાલવાથી સુખમય જીવન પ્રાપ્ત થાય. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે વ્યક્તિગત જીવન કાનૂન. અને 'મુસ્લિમ પર્સનલ લો' નો મતલબ થયો મુસલમાનોના એવા કૌટુંબિક કાયદાઓ જેના ઉપર એક મુસલમાન માણસે અમલ કરવાનો છે.

અહીંયા સવાલ ઉદ્ભવશે કે એવા કાયદાઓ કયા છે જેના ઉપર ચાલવાથી મુસલમાન તરીકે જીવંત રહી શકાય ? તો જાડી લ્યો કે અલ્લાહ તાદ્વાલાએ હજરત મુહમ્મદ સલ્લાલ્હાસુલ્હ અલયહિ વ સલ્લમને અંતિમ નબીનો લક્બ આપી આપ સલ્લાલ્હ અલયહિ વ સલ્લમ ઉપર માનવજીવન માટે એવા ઉપયોગી અને સર્વગ્રાહી સિદ્ધાંતો – આદેશો ઉતાર્યા, જેના ઉપર અમલ કરવાથી સમગ્ર વિશ્વ સંપૂર્ણ રીતે સુખમય જીવન ગુજારી શકે છે. અલ્લાહ તાદ્વાલા ફરમાવે છે : જે માણસ નેક કાર્ય કરશે,

---

ચાહે મર્દ હોય યા ઓરત, શરત એટલી કે તે ઈમાનદાર હોય, તો અમે તે માણસને સુખમય જીવન આપીશું. (સુરએ નહલ). અલ્લાહ તથાલા તરફથી આ સુખમય જીવન માટે જ ઈસ્લામી જીવન બંધારણ ઉપર અમલ કરવાને વાળબ અને જરૂરી ઠેરવવામાં આવ્યું.

સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે મનુષ્યની બધી જ હાલતો (જન્મથી મૃત્યુ સુધી, જન્મ પૂર્વ અને મૃત્યુ પછીની હાલતો)ના આદેશોને આ જીવન કાનૂન આવરી લે છે અને એ બધા જ આદેશો ઉપર અમલની ઈસ્લામ માંગણી કરે છે. સારાંશ કે કોઈ પણ હાલતમાં માણસને બેકાર છોડવામાં આવ્યો નથી. મુસલમાનો માટે સંપૂર્ણ શરીઅત પર અમલ કરવો જરૂરી છે. મુસલમાન આ શરીઅત પર અમલ કરીને એક સંપૂર્ણ મુસ્લિમ તરીકે જ જીવે એ જ ઈસ્લામનો ધ્યેય છે. આ આદેશો અલ્લાહના બનાવેલા છે, એમાં કોઈ માણસને સુધારો વધારો કરવાનો જરાયે હક નથી. કુર્અને પાકમાં અલ્લાહનો ઈરશાદ છે કે કોઈ ઈમાનદાર મર્દ અને ઈમાનદાર ઓરત માટે ગુંજાઈશ નથી કે અલ્લાહ અને એના રસૂલ કોઈ કામનો આદેશ આપી દે પછી તેઓને એ કામમાં બોઈ બીજો ઈખ્તીયાર કે ઓપ્શન બાકી રહે. અને જે માણસ અલ્લાહ અને એના રસૂલનું કહ્યું નહીં માને તે ચોખ્ખી ગુમરાહીમાં પડ્યો. (સુરએ અહજાબ)

હુજૂર (સલ.)નો ઈરશાદ છે કે, જેણે અમારા દીનમાં કોઈ વસ્તુનો વધારો કર્યો તો તે રદ બાતલ થશે. (બુખારી) એનાથી પૂરવાર થાય છે કે મુસલમાન સંપૂર્ણ શરીઅત પર અમલ કરવાથી જ મુસલમાન તરીકે જીવંત રહશે. માટે ખરેખર તો પૂરી શરીઅત જ મુસ્લિમ પર્સનલ લો છે. એમાં કોઈ પણ જતનો

ફેરફાર અથવા સુધારો વધારો ગુમરાહી છે.

હવે એ પ્રશ્ન રહ્યો કે પછી માત્ર થોડીક બાબતો અને ગણ્યા ગાંઠયા આદેશોને જ મુસ્લિમ પર્સનલ લો કેમ કહેવાય છે ? તો એનો ઉત્તર એ છે કે ભારતમાં આ બધું અંગ્રેજોનું કારસ્તાન અને એમના રાજકીય કાવાદાવાઓનું પરિણામ છે.

૧૮૫૭ની આજાઈની લડતમાં જ્યારે અંગ્રેજો સફળ રહ્યા તો તેઓએ આ લડત ચલાવનારાઓ ઉપર ચાહે મુસલમાન હોય યા ગેરમુસ્લિમ, ભારે અત્યાચારો કર્યા. હજારોની ખુલ્લેઆમ કંતલ ચલાવી. સેંકડોને આજીવન કેદમાં નાખ્યા અને બીજા સેંકડોને કાળા પાણીની સજા આપી. આ બધું કરવા છતાં એમને ભય હતો કે અમારા આ અત્યાચારનો ભાંડો ન ફુટી જાય, એટલા માટે એણે વિવિધ તરફીબો અપનાવવી શરૂ કરી.

જ્યારે અંગ્રેજોએ સત્તા ઉપર કબજો કર્યો ત્યારે પૂરા દેશમાં ઈસ્લામી કાનૂન લાગુ હતો અને મુસ્લિમ તથા ગેરમુસ્લિમ બધા જ સુખમય જીવન પસાર કરી રહ્યા હતા. કારણ કે ઈસ્લામી શાસનકાળમાં પણ બધી જ કોમો અને દરેક સમાજને સંપૂર્ણ સ્વાધીનતા આપવામાં આવી હતી કે પોતાના સામાજિક પ્રશ્નો પોતાના ધર્મ મુજબ હલ કરે અને એ વિષયમાં તેઓ સંપૂર્ણ મુક્ત હતા. ઈસ્લામે તેમના આ કાયદાઓને ત્યાં સુધી રક્ષણ આપ્યું છે કે અગર નિકાહ પછી બન્નેવ પતિ-પતિની ઈસ્લામ ધર્મ અંગીકાર કરે તો પણ એમણે ગેરમુસ્લિમ હોવાની હાલતમાં કરેલ નિકાહ માન્ય અને ચાલુ રહેશે. અંગ્રેજો એ વસ્તુ ઘણી સારી રીતે સમજતા હતા કે હમણા ઈસ્લામી કાનૂનમાં કોઈ ફાટ પાડવામાં આવી તો એમના અત્યાચારોનો ઘડો ફુટી જશો, જેને સુધારવું અશક્ય થઈ પડશે. બીજું એક કારણ એ પણ હતું કે

મુસલમાનો ચાહે અમારી સત્તાના હેઠળ તાબામાં આવી ગયા છે પરંતુ ઈસ્લામી કાનૂન એમનો દીન અને એમનું ઈમાન છે. એ જ એમનો જીવનમંત્ર છે, મુસલમાન એને પોતાનો ધાર્મિક કાનૂન પણ સમજે છે અને વ્યક્તિગત કાનૂન પણ સમજે છે. જો એમાં અત્યારથી જ ફેરબદ્ધ અથવા ખતમ કરવામાં આવ્યો તો મુસલમાનો એને સાંખી નહી લે, માટે અંગ્રેજોએ તુરંત તો ઈસ્લામી કાનૂન ખતમ નહી કર્યો, પરંતુ એને તોડવાની ફિકરમાં લાગી ગયા. સૌ પ્રથમ તો એમણે પોતાના જુના સિદ્ધાંત 'લડાવો રાજ કરો' પ્રમાણે અમલ કરી મુસ્લીમ અને ગેરમુસ્લીમોમાં મતભેદો પૈદા કર્યા અને જ્યારે એ મજબૂત થયા તો ધીરેધીરે કાનૂનમાં ફેરફાર કરવાની નીતિ અમલમાં આણી.

સૌ પ્રથમ ઈસ્લામી ફોજદારી કાનૂનને જુલ્દી બતાવી તેને ખતમ કર્યો. ત્યાર પછી દેશમાં બે જાતની અદાલતો મુસ્લિમ અને ગેરમુસ્લિમ ઉભી કરવામાં આવી અને ઘણી જ સિફત પૂર્વક કહેવામાં આવ્યું કે મુસ્લીમો પોતાની બાબતો મુસ્લિમ અદાલતમાં રજૂ કરે અને ગેરમુસ્લિમો પોતાની બાબતો ગેરમુસ્લિમ અદાલતોમાં રજૂ કરે. આ પગલું ઈ.સ. ૧૮૬૭માં ભર્યું, જેના પરિણામરૂપે મુસ્લિમ અને ગેરમુસ્લિમ મતભેદની ખાઈ વધુ ઊંડી થતી ગઈ અને બન્નેવ કૌમની આપસની એકતા જે અંગ્રેજ સત્તા માટે પડકારરૂપ હતી, તેનાથી અંગ્રેજે છુટકારો મેળવ્યો. મુસ્લીમ અદાલતોમાં જે કાનૂન લાગુ કરવામાં આવ્યો તેનું નામ મોમેઝન લો આપવામાં આવ્યું. એ 'લો' પણ હુબહુ રાખવામાં ન આવ્યો, બલકે એમાં પણ ફેરફારો કરી નાખ્યા. ઓના ઉપર મુસલમાનોએ આવાજ પણ ઉઠાવ્યો, પરંતુ ભારતીય પ્રજાના આપસના વિખવાને લઈ એ તરફ અંગ્રેજોએ

ધ્યાન ન આપ્યું. પછી કેટલાક મુસ્લિમ અને ગોરમુસ્લિમોને પોતાના પક્ષે લઈ લગભગ ૧૮૭૭ ઈસ્વીમાં નવો ખરડો તૈયાર કર્યો અને મોમેડન લો માં ફેરફાર કરી તેમાંથી ઘણી બાબતોને કાઢી નાખી માત્ર થોડીક બાબતો જ જે મકે નિકાહ, તલાક, વિરાસત, વસીયત, બક્ષીસ, ભરણપોષણ, વક્ફ વગેરે જે કુલ મળી પંદર થાય છે બાકી રાખી અને તેને મુસ્લિમ પર્સનલ લોનું નામ આપવામાં આવ્યું.

આ છે હાલના મુસ્લિમ પર્સનલ લોનો ટુંકો ઈતિહાસ અને તેની હકીકત. જેને અંગ્રેજ સરકારે પોતાની સત્તા હેઠળ ના છુટકે લાગુ રાખવાનું માન્ય રાખ્યું હતું અને એ જ મુજબ દિવાની કોર્ટો ફેસલા કરતી હતી. નહીં તો અંગ્રેજોનો ધ્યેય તો ભારતમાં સંપૂર્ણ રીતે ઈસાયતને જ ફેલાવો આપવાનો હતો. પરંતુ મુસ્લમાનોના ભારે પ્રતિકારને લઈ તેનું આ સ્વખન ફળી ન શક્યું.

ધર્મનો વિરોધ કરી ભારત પર સત્તા જાળવવી શક્ય પણ ન હતી એટલે તેઓએ ધાર્મિક બાબતોની અદાયગી તથા ધર્મ પરિવર્તન અને અનુસરણ તેમજ દરેકને તેના ધર્મના પ્રચાર – પ્રસારની સ્વતંત્રતાનું એલાન કર્યું.

ઈસ્લામના બુનિયાદી સિદ્ધાંતો ઉપર આધારિત મુસ્લિમ સમાજના એક અંગ સમાન ઈસ્લામી કાયદાઓના રક્ષણની ગેરંટી આપીને અદાલતોને પાબંદ બનાવી કે ઉપરોક્ત બાબતોમાં મુસ્લીમોના ધાર્મિક કાયદાઓ પ્રમાણે ફેસલા કરે. કાયદાની પોઢીમાં એને જ 'મુસ્લિમ પર્સનલ લો' નું નામ આપવામાં આવ્યું.

કેટલીક બાબતોમાં ફેસલો લાગુ થવા માટે મુસ્લમાન જજ અથવા કાળજી જે શરત હતી તે પણ પાછળથી ફગાવી દેવામાં

આવી, એટલા માટે જ કેટલીક બાબત તો મુસ્લીમ પર્સનલ લો હેઠળ આવતી હોવા છતાં અદાલતના ફેસલાને મુસલમાનોએ માન્ય ન રાખ્યો.

મુસ્લીમ પર્સનલ લોનું વર્તુળ જે બાબતોને આવરી લેતું હતું તેમાં શરીયતના ફતવા પ્રમાણે ફેસલો કરવામાં આવતો હતો અને અંગ્રેજોના પુરા શાસનકાળમાં ક્યારેય એ પ્રશ્ન ન ઉઠ્યો કે દીવાની અદાલતે મુસ્લિમ સામાજિક ખરડા વિરોધ ફેસલો આપ્યો છે.

આજાદીની લડતમાં ભાગ લેનારા મુસ્લીમોને શ્રદ્ધા હતી કે ભારતની આજાદી પછી ધાર્મિક બાબતોને અંગ્રેજોએ આપેલી આંશિક સ્વતંત્રતાથી વધુ બહોળારૂપમાં સ્વતંત્રતા પ્રાપ્ત થશે, અને આજાદી પછી જે કંઈ મળશે તે હક્કુપે અમને મળશે, પણ વાસ્તવમાં આ એક વધુ પડતી આશા હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો અમો એવું સમજવા ઉપર મજબુર થયા કે "ખ્વાબ થા જો કુછ કે દેખા, જો સુના અફ્સાના થા" મુસલમાનો અમે બેકાર હરખાતા રહ્યા અને હવાઈ કિલ્લા બનાવતા રહ્યા.

### મુસ્લિમ પર્સનલ લોનું મહત્વ

અત્યાર સુધીની વિગતથી આપણે જાણી ચુક્યા છીએ કે ખરેખર તો મુસ્લિમ પર્સનલ લો પુરી શરીયત જ છે. પરંતુ આ શબ્દનો વપરાશ અત્યારે માત્ર મુસ્લિમોની ફક્ત તે પંદર બાબતોને જ આવરી લે છે જેને મુસ્લિમ પર્સનલ લો તરીકે ભારતીય બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પણ નિકાહ, તલાક, વારસાઈને લગતી સામાજિક બાબતો ઉપર આ શબ્દ વધુ ભાગે બોલાય છે. આપણે એને 'ફેમીલી લો'થી પણ

ઓળખી શકીએ છીએ.

'કેમીલી લો'નું શું મહત્વ છે તે આપણે જાણી લેવું જોઈએ.  
જેથી એના રક્ષણ કાજે કરવામાં આવતી કોશીશોમાં દરેક  
મુસલમાન ભરપુર હિસ્સો લઈ શકે.

કૌમો માટે એમના જીવન મુલ્યો, જીવન આદર્શો અને તેના  
સિદ્ધાંતો તથા તેનું કાયદાકીય માળખું પ્રાણ ઘ્યારુ હોય છે,  
ધાર્મિક દાખિકોણ, સંસ્કારો, પરંપરાઓ અને રીતરિવાજો, કોઈ  
પણ કૌમની સંસ્કૃતિના સ્ત્રોત અને બુનિયાદી પાયાઓ છે. પરંતુ  
આ સહુમાં પર્સનલ લો કરોડરજજુનું સ્થાન ધરાવે છે. બીજા  
શબ્દોમાં કહી શકીએ કે કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિની રૂહ એના  
પર્સનલ લોમાં છુપાયેલી હોય છે. સામાજિક કાયદાઓમાં જ જે  
તે કૌમના ખૂબીઓ, દાખિબિંદુ, વિચારરસણી, ઓળખ અને  
શ્રદ્ધાના ચિંહો તેમજ જલક જોઈ શકાય છે. બીજી કૌમોને મન  
સામાજિક કાયદાનું મહત્વ હોય કે ન હોય, મુસલમાનોને મન તો  
એનો દરજજો સર્વ સામાન્ય છે. એમનો પર્સનલ લો એમના  
ઈમાન અને શ્રદ્ધાનો અતુટ હિસ્સો છે. મુસલમાનોને કુર્અન  
અને સુન્નત ઉપર ઈમાનનો આદેશ છે. અને આ કાયદાઓ એ  
બન્નેવમાં સપણ્ટ રૂપે મવજૂદ છે. આ કાયદા ઈસ્લામી  
શરીઅતનું મહત્વનું અંગ છે. એના ઉપર ચાલવાથી મુસલમાન  
મુસલમાન બને છે. આ કાયદાઓ અગર બદલાય જાય તો  
ઉમ્મતનું માનસ અને તેની રીતભાત બદલાય જાય. એનું  
સામાજિક માળખું નાણ થઈ જાય. કૌટુંબિક વ્યવસ્થા અસ્ત  
વ્યસ્ત થઈ જાય. જે લોકો સોસ્યાલીસ્ટ વિચારસરણી લાવી  
ધર્મનો ખાત્મો બોલાવવા ચાહે છે અથવા બહુમતી વર્ગના તે

તત્વો જે હિન્દુ વિચારસરણી પુરા દેશમાં લાદવા ચાહે છે, એમની રાહમાં આ કાયદાઓ જ મોટામાં મોટી રૂકાવટ છે.

મુસ્લિમોએ યાદ રાખવું જોઈએ કે કામિલ ઈસ્લામ અને અંતિમ ધર્મનો શું મતલબ છે? અને તેનો શું તકાદો છે? હજરત અબુલ્લાહ ઈબ્ને સલામ (રદી.)એ જ્યારે એક જાઈજ વસ્તુ (ઉંટના ગોસ્ત)ને પોતાના ઉપર હરામ ઠેરવી લીધો તો એમનાથી કામિલ ઈસ્લામની માંગણી કરવામાં આવી. "યા અચ્યુહલ્લાજીના આમનુદ્ભુલૂ ફિસ્સિસલમી કાફિઝતન" (હે ઈમાનીઓ! ઈસ્લામમાં પુરેપુરા આવી જાવ). હુઝૂર (સલ.)એ જ્યારે એક હલાલ વસ્તુથી બચવાનું શરૂ કર્યું તો આપને સંબોધન કરવામાં આવ્યું કે અલ્લાહની હલાલ કરેલી વસ્તુને હરામ કેમ ઠેરવો છો?

શરીઅતનો સર્વમાન્ય કાનૂન છે કે હરામને હલાલ કે હલાલને હરામ નથી બનાવી શકાતું. એ જ પ્રમાણે મુસ્તહબ કે જાઈજ કામને પણ ન તો તેના દરજાથી વધારીને ફર્જ વાજિબ બનાવી શકાય છે? અને ન તો એને મકરૂહ કે હરામ ઠેરવી શકાય છે. ઈસ્લામમાં કાયદાનું ઘડતર અલ્લાહના જ હાથમાં છે. માણસને એમાં સત્તા આપવામાં આવી નથી.

**પરંબના લો, સમાજના અસ્તિત્વની બુનિયાદ છે.**

કોઈ શરીર અગર રૂહ વિના અને જાડ વિના રહી શકતું ન હોય તો કોઈ મિલત અને કૌમ પોતાના સામાજિક માળખા તથા કૌટુંબિક વ્યવસ્થા વગર કેવી રીતે જીવંત રહી શકે છે. બીજી કોઈ કૌમ માટે એનું મહત્વ હોય કે ન હોય, મુસલમાનો માટે તો છે જ. એટલા માટે કે મુસલમાનનું અસ્તિત્વ જ ઈમાન

અને ઈસ્લામ કિંવા માનવા અને અનુકરણ કરવા તથા અલ્લાહ અને એના રસૂલની ફરમાબરદારીમાં છે. આ ઈસ્લામ તથા ઈમાન માત્ર મોઢેથી જ નહીં, બલકે કર્તવ્યથી પણ એના પુરા જીવનમાં જીવંત અને લાગુ હોવા જોઈએ.

પર્સનલ લો ઉપર એક તરફ ઈમાન અને અકીદાની બુનિયાદ છે તો બીજી બાજુ ઉમમતે મુસિલમાનું અસ્તિત્વ એના ઉપર જ અવલંબિત છે. આ તે બે ધારી તલવાર છે જેને અગર કોઈ કૌમના વિરુદ્ધ વાપરવામાં આવે તો એના આંતરિક અસ્તિત્વની સાથો સાથ એની બાહ્ય હસ્તી તથા દેખાવને પણ નેસ્તોનાભુદ કરી દે છે. સામાજિક માળખાનો સંપૂર્ણ પાયો આ પર્સનલ લો જ હોય છે. વ્યક્તિની કેળવણી અને ઘડતર, તેનો ઉછેર, કુટુંબના સત્યો સાથેના એના સંબંધોનું રૂપ, ઘરનો આંતરિક પ્રોટોકોલ અને કુટુંબનું માળખું, મતલબ કે એક નાનકડી દુનિયાનો પાયો આ કાયદાઓ ઉપર જ હોય છે. જે આગળ જતાં એક મહોલ્લો, એક શહેર, એક કૌમ અને એક દેશ બને છે.

દરેક ધાર્મિક શ્રદ્ધા, વૈચારિક માળખું અને જીવન વ્યવસ્થાને પોતાના અસ્તિત્વ માટે કોઈ ને કોઈ સમાજ અથવા સંસ્કૃતિની જરૂરત હોય છે. જેમાં તે ફાલીકુલી શકે અને પ્રગતિના શિખરો સર કરી શકે. ધર્મ હોય યા ચળવળ, બન્નેવને પોતાના પગ જમાવવા માટે જમીનની જરૂરત હોય છે. તેના અસ્તિત્વ અને ભવિષ્યમાં ટકી રહેવા માટે એક એવું સામાજિક માળખું આવશ્યક છે જે અકીદાઓ તથા કેળવણી ઉપર દિલથી શ્રદ્ધા રાખતું હોય અને પોતાના જીવનમાં એને ઉતારતું હોય.

### પરસ્નલ લો સમાજની ઓળખ હોય છે.

પરસ્નલ લો કોઈ એવી વસ્તુ નથી જેનું હોવું અને ન હોવું કોઈ કોમ અને સમાજ માટે એક સરખું હોય, કૌમના માનસ, સ્વભાવ અને એમના સામુહિક જીવનનો જીહેરી અને બાહ્ય દેખાવ અને ચેહરો બધું જ 'પરસ્નલ લો'ની ભેટ હોય છે, વિશ્વની કોઈ કૌમ એવી નથી બતાવી શકતી (ચાહે તે પ્રગતિશીલ હોય અથવા જંગલી) જે પોતાનું સ્વતંત્ર કૌટુંબિક માળખું રાખતી ન હોય, પછી તે માળખું સામાજિક પ્રગતિના પરિણામરૂપે બન્યું હોય અથવા વહી અને ખુદાઈ કાનૂન વડે તૈયાર કરવામાં આવ્યું હોય.

બીજી સંસ્કૃતિઓની જેમ ઈસ્લામી સંસ્કૃતિ પણ મોટે ભાગે પોતાના અસ્તિત્વમાં પરસ્નલ લો ઉપર જ આધાર રાખે છે. જે લોકો એવું સમજી રહ્યા છે કે સામાજિક કાયદાઓમાં નજીવા ફેરફાર અને સુધારા વધારાથી શું કયામત આવી જવાની છે ? અને કયું આભ તુટી પડવાનું છે જે પુરી કૌમને નાષ્ટ કરી દેશે અને ઉભ્મતે મુસ્લિમહનું અસ્તિત્વ જોખમાઈ જશે ? તેઓ મોટી ગેરસમજ અને મિલ્લત ફરોશીના શિકાર છે. અકકલ અને હોશિયારીના નામે પુરી કૌમનો સોદો કરી રહ્યા છે. તે લોકો એવું વિચારે છે કે ભલા આટલી મોટી પંદર કરોડની વસતી ઘરાવતી કૌમ કેવી રીતે થોડાક કાયદાઓને લઈ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખશે ! જેઓની વિચાર શૈલી આ છે તેઓ યા તો સંસ્કૃતિ અને કૌમી સામુહિક માળખાની ઘણી જ મર્યાદિત અને અધુરી વ્યાખ્યા રાખે છે. તેઓની નજર કૌમના આંતરિક અસ્તિત્વ સુધી નથી પહોંચી અથવા તો તેઓ મુનાફિક અને

ધોકાબાળ છે. એમનો અંતરાત્મા મરી પરવારો છે. એટલે તેઓ પર્સનલ લોનું મહત્વ જાગ્રવા છતાં તેમાં ફેરફાર તથા સુધારા વધારાને સાંખી રહ્યા છે.

### પર્સનલ લો ખતમ થવાના દૃષ્ટિદ્યામો.

ચીન અને રશિયા એક સમયે મુસ્લિમ સંસ્કૃતિનાં કેન્દ્રો અને મુસ્લિમ ઈલાકાઓ હતા, પરંતુ સામ્યવાદી વિચારસરણી તથા કોમ્યુનિષ્ટોના દ્વારા દીરે દીરે ઈસ્લામી સંસ્કૃતિના ચિન્હો નાણ થતાં ગયાં અને સામાજિક માળખાના ફેરફારે રશિયામાં મુસ્લિમોના અસ્તિત્વને જ શંકાસ્પદ બનાવી દીધું. ઈમામ બુખારી તથા બીજી મહાન આલિમોનું વતન જ ઈસ્લામનું દુશ્મન બની ગયું. બુખારા, સમરકંદ, ઘ્વારજમ, જુરજાન, તાશકંદ, તાજકિસ્તાન અને તુર્કિસ્તાનથી કાશગાર સુધી ન તો ઈસ્લામી સંસ્કૃતિ છે ન તો મુસ્લીમોનું આગવું સામાજિક અસ્તિત્વ.

વિશ્વના કોઈ ભાગમાં જ્યાં મુસલમાનોનું કોઈ સામાજિક માળખું અને તેનો મજબુત પાયો નથી રહ્યો અથવા તેમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો તેનું પરિણામ શું આવ્યું ? ધીરે ધીરે તેઓ ઈસ્લામથી દૂર થઈ ગયા અને બીજુ જ કંઈ રૂપ ધારણ કરી લીધું અથવા બહુમતિ સંસ્કૃતિમાં વિલીન થઈ ગયા. પોતાને મુસલમાન કહેડાવતી ભારતની કેટલીક કૌમો ઈસ્લામ અને ઈસ્લામી સંસ્કૃતિથી એટલી દૂર થઈ ચૂકી છે અને તેઓની ઈસ્લામી ઓળખ એટલી બદલાય ચૂકી છે કે તે કૌમો મુસ્લિમ ઓળખથી ઓળખાતી નથી. તેઓને દીનથી બિલકુલ હટાવી દેવું ધાણું જ સરળ છે. તેઓમાં આ ફેરફાર શાદી, વિવાહ, રસમો રિવાજ અને બિનઈસ્લામી સંસ્કૃતિને અપનાવવાથી જ આવ્યો

છ. જોણે છેલ્લે તેઓને ઈલ્હાદ અને ઈર્તીદાદ (દીનથી ફરી જવા) સુધી પહોંચાડીને દમ લીધો.

અમને કોઈ સંસ્કૃતિથી હુશમનાવટ નથી, પરંતુ અમને બીજાઓ પર દ્યા જરૂર આવે છે. માનવીય એકતા અને બંધુત્વના નાતે અમે તેઓ ઉપર રહમ ખાઈએ છીએ, જેઓ પક્ષિયમની અસરથી અથવા વૈચારિક અસ્પષ્ટતાના કારણે એમની સંસ્કૃતિ અને ધર્મ બાબતે અવઘવના શિકાર છે અને તેઓ પોતાને જબરદસ્તી તેની સાથે જોડીને અને તેને ગળે વળગાડીને ફરી રહ્યા છે.

અમને મુસલમાનોને તો પોતાની સંસ્કૃતિ, પોતાના જીવન આદર્શ, પોતાના ક્રોટુંબિક માળખું, પોતાનો પર્સનલ લો અને અને પોતાના સામાજિક ધારા ઉપર ગર્વ છે, અમે તેને સાંસ્કૃતિક વારસા રૂપે જ નહીં, ઐતિહાસિક ભેટ રૂપે જ નહીં, બલકે ધાર્મિક ભાવનાઓ અને શ્રદ્ધાઓ તથા અકલ અને હોશિયારીની સાથે પોતાની છાતીથી લગાવી રહ્યા છીએ, અમે તેને માત્ર પોતાના માટે જ સફળતા અને ઉચ્ચતાનું કારણ નથી સમજતા, બલકે પુરા વિશ્વની ભલાઈ, જેરો બરકત અને પુરી મનુષ્ય જીતિનો છૂટકારો એમાં જ સમજીએ છીએ. અમે પોતાના સામાજિક માળખા અને પર્સનલ લોને બીજા કોઈ ઉપર જબરદસ્તી અને બળજબરી પૂર્વક લાદવા નથી માંગતા, અને ન તો અમને ધર્મ એની રજા આપે છે, પરંતુ એ સાથે જ અમે બીજી કૌમના રિવાજો અને કાનૂનને પોતાના માથે પણ લેવા નથી માંગતા અને ન તો અમારો ધર્મ તથા ઈમાન પણ એની લેશ માત્ર રજા આપે છે.

## આજાદ ભારતનું બંધારણ અને પસંદ લો

ભારતને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરવા અને તેઓના જાતીમ પંજામાંથી છોડાવવા માટે જે લાંબી જંગ ખેલવામાં આવી, એમાં મુસ્લિમ મુજાહિદો પણ કોઈનાથી પાછળ નથી રહ્યા. જેલની દીવારો, કેદ્ખાનાની કાળકોઠીઓ, ફાંસીના ફંદા, બંદૂકની ગોળીઓ, તોપના ગોળાઓ, જાડો પર લટકતી અને ઝૂલતી લાશો, ઉકળતા તેલમાં બાળવામાં આવતા શરીરો, કાળા પાણીની સજા અને એ સિવાયના બધા જ દર્દ ભર્યા જુલ્દ્મો અને તેની દાસ્તાનો મુસ્લિમ શહીદો અને જંગે આજાઈના વીરોના પરાક્રમોથી રંગાયેલી છે.

મુસલમાનોએ આ બધી કુર્બાનીઓ માત્ર એટલા માટે જ આપી હતી કે દેશને અંગ્રેજના જુલ્દ્મી શાશન અને તેની ગુલામીથી આજાદ કરાવી એક આજાદ દેશના નાગરિક તરીકે પ્રાપ્ત થતા હકો મેળવી સ્વતંત્ર જીવન ગુજરીએ, માટે જ્યારે દેશને આજાઈ મળી અને આજાદ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું (બંધારણ ઘડનારા પણ તે લોકો જ હતા જે મણે આજાઈની જંગમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો) ત્યારે આ દેશને બિનસાંપ્રદાયિક અને સેક્યુલર દેશ જહેર કરવામાં આવ્યો. જેનો મતલબ જ એ છે કે ભારતનો કોઈ સરકારી ધર્મ નથી, બલકે તે દરેક ધર્મને માનની નજરે જુએ છે અને તેના માનનારાઓને પોતાના ધર્મ ઉપર ચાલવાની અને પોતાની શ્રદ્ધા તથા ઈમાન મુજબ ઈબાદત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. ભારતીય બંધારણમાં ત્રીજા પ્રકરણમાં ભારતીય નાગરિકોના કેટલાક બૂનિયાદી હકો માન્ય રાખવામાં આવ્યા છે અને તે

હકોના રક્ષણની ગેરંટી આપવામાં આવી છે, એમાંનો જ એક હક્ક જે કલમ ૨૫ (૧) હેઠળ અંકાસેલો છે. જે નીચે મુજબ છે.

બધી જ વ્યક્તિત્વોને આત્માની સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે ધર્મ સ્વીકારવા, તે ઉપર ચાલવા અને તેનો પ્રચાર કરવાનો સમાન હક છે. શર્ત માત્ર એટલી જ કે જાહેર સલામતી, જાહેર સંસ્કાર, જાહેર સ્વાસ્થ્ય અને એ વિભાગના બીજા એકમોને આંચ ન આવે. જેનો મતલબ એ થયો કે દરેક માણસને સ્વતંત્ર રીતે ધર્મને માનવાનો, તેનો પ્રચાર પ્રસાર કરવાનો અને તે ઉપર ચાલવાનો સમાન હક્ક છે. શર્ત એટલી જ કે જાહેર સલામતી વિગેરે એનાથી જોખમાતી ન હોય. બંધારણના એ જ પ્રકરણમાં કલમ ૧૩ (૨) માં ચોખવટ કરવામાં આવી છે કે 'સરકાર કોઈ એવો કાયદો નહી ઘડે જે આ ભાગ વડે આપવામાં આવેલા હકોને છીનવી લેતો હોય અથવા એમાં ઘટાડો કરતો હોય અને જે કાનૂન આ ફકરાની વિરુદ્ધમાં બનાવવામાં આવશે તે વિરોધાઈની હદ પુરતો રદ્ભાતલ ઠરશે.'

એ જ પ્રકરણની કલમ ૩૮ વડે નાગરિકોના દરેક વર્ગને પોતાની આગવી સંસ્કૃતિ આરક્ષિત રાખવાની પણ ગેરંટી આપવામાં આવી છે. જેનો મતલબ એ થયો કે સરકાર એવો કોઈ કાનૂન નહી ઘડે જે બંધારણો આપેલા બૂનિયાદી હકો (જેમ કે ધાર્મિક બાબતોની સ્વતંત્રતા દરેક વર્ગની આગવી સંસ્કૃતિનું આરક્ષણ વિગેરે)ને છીનવી લેતો હોય અથવા તેમાં ઘટાડો કરતો હોય. અગર કોઈ કાયદો એવો ઘડવામાં આવ્યો જે કોઈ પણ બૂનિયાદી હકને હાની પહોંચાડે છે તે કાયદો બંધારણ વિરુદ્ધ લેખાશે. આપણી સામે એના કેટલાય દાખલા મવજૂદ છે.

સુપ્રિમ કોર્ટ ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ સગીર અહમદનો કેસ અને ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ દીપચંદના કેસમાં આ ફેસલા પર અમલ કરતાં તે કાયદાના બંધારણ વિરુદ્ધ હોવાનું એલાન કર્યું હતું જે બુનિયાદી હકોને હાની પહોંચાડી રહ્યા હતા. એ જ પ્રમાણે સુપ્રિમ કોર્ટ કેરળ સરકાર વિરુદ્ધ કિશોરચંદ્ર ભારતીના કેસના ફેસલામાં એક સિધ્ઘાતં ઘડી કાઢ્યો જેમાં પાર્લામેન્ટ વડે બુનિયાદી હકોને હાની પહોંચાડનાર કોઈ પણ ફેરફારનો દરવાજો બંધ કરી આપ્યો અને કહ્યું કે પાર્લામેન્ટ બંધારણની આ પાંચ બુનિયાદી વાતોને કોઈ પણ ફેરફાર વડે ખતમ નથી કરી શકતી. જેના ઉપર બંધારણના બુનિયાદી માળખાનો આધાર છે, તે પાંચ વાતોમાંથી એક બંધારણનો સેક્યુલર ચહેરો પણ છે. એ જ પ્રમાણે સુપ્રિમ કોર્ટ મથરા હિરા વિરુદ્ધ કિશ્શાસિંઘના કેસમાં અલહાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કિર્તીને એવું કહી ચીમકી આપી કે અમારા માનવા મુજબ હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ ભારતીય બંધારણની આ વાત નજર સમક્ષ ન રાખી કે બન્નેવ પક્ષોના પર્સનલ લોને ચર્ચાનો વિષય બનાવવામાં નહીં આવે. બન્નેવ પક્ષોના પર્સનલ લોને લાગુ કરતી વખતે તેઓ (ન્યાયમૂર્તિ) પોતાના વિચારો દર્શાવી નથી શકતા, બલકે તેઓએ (હિન્હ) પર્સનલ લોના વિશ્વાસપાત્ર અને સર્વ માન્ય કાનૂનો જ લાગુ કરવા જોઈએ.

ભારતીય બંધારણની કલમો અને પર્સનલ લો વિષે સુપ્રિમ કોર્ટની અગાઉની નીતિથી જાણી શકાય છે કે ભારતમાં તમામ ધર્મના લોકોને સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા છે, પોતે પોતાના ધર્મ ઉપર મુક્ત રીતે ચાલી શકે છે. સરકાર એમાં કોઈ પણ

દુખલગીરી નહી કરે અને ન તો કોઈ એવો કાયદો ઘડશે કે જેનાથી બંધારણ વડે આપવામાં આવેલા હકોને હાની પહોંચતી હોય.

### કાયદાની ભૂલ ભૂલામણી.

બંધારણના ચોથા પ્રકરણમાં સરકારની કાર્યવાહક નીતિ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બતાવવામાં આવ્યા છે. તેની કલમ ૪૪માં છે કે 'સરકાર એ કોશીશ કરશે કે ભારતના પુરા ઈલાકામાં નાગરિકો માટે સમાન સિવીલ કોડની ખાત્રી હોય'. આ બંધારણની તે કલમ છે જેને સમાન સિવીલ કોડની માંગણી કરનારાઓ આગળ ધરી સમાન સિવીલ કોડ લાગુ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે.

એ માટે સર્વ પ્રથમ તો એ જાણી લેવું જોઈએ કે આજાઢી પછી બંધારણ ઘડનારી એસેમ્બલીમાં જ્યારે દેશનું નવું બંધારણ તૈયાર થઈ રહ્યું હતું અને પસાર થનાર બંધારણની કલમો ચર્ચા હેઠળ હતી ત્યારે બુનિયાદી હક્કોને લગતી પેટા કમિટીમાં સમાન સિવીલ કોડનો સમાવેશ કરવાની વાત આવી. ૧૯૪૭માં આ પહેલો મોકો હતો કે બંધારણ ઘડનારી એસેમ્બલીમાં પહેલી વખત આ આવાજ સંભળાઈ ચર્ચા એ હતી કે દેશના બંધારણના ચોથા પ્રકરણમાં સરકારની કાર્યવાહક નીતિ માટેના માર્ગદર્શક ઉસ્કૂલોમાં સમાન સિવીલ કોડની એક કલમનો સમાવેશ કરવામાં આવે, જે ધર્મ અને કૌમના ભેદભાવ વગર દેશના બધા જ રહેવાસીઓ ઉપર લાગુ પાડી શકાય. આ ઠરાવને બુનિયાદી હકોની પેટા કમિટીએ એક વખત ૨૮ માર્ચ ૧૯૪૭ની મીટિંગમાં નામંજૂર કર્યો હતો. બીજાવાર ૩૦ માર્ચ ૧૯૪૭ની

મીટીગમાં ઘણી જ પાતળી બહુમતીથી પાસ થઈ ગયો અને બંધારણના પ્રકરણ રૂમાં કલમ ૪૪ રૂપે એનો સમાવેશ થયો. તે વેળા એસમ્બલીના કેટલાક સભ્યોએ આ ઠરાવનો ઘોર વિરોધ કર્યો એક સભ્યએ એ પણ કોશીશ કરી અને તે કોશીશમાં ત્રણ ઠરાવો મુક્યા જેની બુનિયાદ પર ધાર્મિક આજાદીના બુનિયાદી હકોવાળી કલમમાં મુસ્લીમ પર્સનલ લોના આરક્ષણની ગેરંટી મળી જાય પરંતુ ઠરાવના આ વિરોધ અને "આ—રક્ષણ"ની આ કોશીશ સફળ ન થઈ શકી, તેના બદલે ડૉ.આંબેડકરે બંધારણ ઘડનારી એસમ્બલીમાં વિરોધ કરનારાઓને આશ્વાસન આપી સમજાવી પટાવી ચુપ કર્યા, જ્યારે આપણે ડૉ.આંબેડકરનું તે વખતનું ભાષણ જે એમણે મુસ્લીમ સભ્યોને સંતોષિત કરવા માટે આચ્યું હતું વાંચીએ છીએ તો વિચાર થાય છે કે જો આજે તેઓ જીવંત હોત તો જોઈ શકત કે તેમના તરફથી આપવામાં આવેલા આશ્વાસન અને રક્ષણના વાયદાઓનો શું હાલ થઈ રહ્યો છે ?

બીજી વાત એ કે જ્યારે બંધારણના ચોથા પ્રકરણની આ કલમ માત્ર એક માર્ગદર્શક સિદ્ધાંતની હેસીયત રાખે છે. એની સામે બુનિયાદી હકને હર હાલતમાં સર્વોપરિતા પ્રાપ્ત થાય છે. મતલબ એ છે બુનિયાદી હકોથી અગર માર્ગદર્શક ઉસુલો કોઈ વખત ટકરાય જાય તો માર્ગદર્શક ઉસુલને છોડવો પડશે. અને એ વાત ચોઘ્ઝી છે કે મુસ્લીમ પર્સનલ લોનો સમાવેશ બુનિયાદી હકોમાંથી છે. તેને ખતમ કરીને સમાન સિવીલ કોડ કેવી રીતે લાગુ કરી શકાય ? એટલા માટે સમાન સિવીલ કોડ હોય યા એના જેવો બીજો કોઈ કાયદો, અગર પાર્લામેન્ટ અથવા કોઈ

રાજ્યની કાયદા ઘડનારી કમીટી ઘડશે અને તે બુનિયાદી હકોથી ટકરાતો હશે તો તે બંધારણ વિરુદ્ધ કહેવાશે, સાથે જ બુનિયાદી હકોની ધણાવટમાં સુધારો કરીને પણ ફેરફાર માટે કોઈ બહાનું બનાવી શકતું નથી, કારણ કે આ બુનિયાદી હકોનો સમાવેશ રાષ્ટ્રસંઘના બુનિયાદી હકોના ઢંઢેરામાં પણ છે અને બુનિયાદી હકોના એ ઢંઢેરા ઉપર ભારત સરકારે પણ સહી કરી છે અને આ ચાર્ટર માનવા માટે પોતાને પાબંદ બનાવી લીધી છે.

બંધારણની કલમ ઉર માં યોખવટ છે કે દરેક બુનિયાદી હક્કને સુપ્રિમ કોર્ટ વડે લાગુ કરી શકાશે. જેના હેઠળ દરેક હાઈકોર્ટમાં કોઈ પણ હક્કને લાગુ કરાવવા માટે રિટ દાખલ કરી શકાય છે. પરંતુ માર્ગદર્શક સિદ્ધાંત માટે એવી કોઈ ગુંજાઈશ રાખવામાં આવી નથી. એટલે અગર સરકાર કોઈ માર્ગદર્શક સિદ્ધાંત પર અમલ કરવામાં કોતાહી કરે તો દેશની કોઈ અદાલત સરકારને એના ઉપર તાકીદે અમલ કરવા માટે મજબૂર નથી કરી શકતી અને જો સરકાર એના ઉપર અમલ ન કરે તો એનાથી જવાબ પણ માંગી શકતો નથી. મતલબ કે બુનિયાદી હકોના વિરુદ્ધ માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતની સત્તાથી બહાર છે.

કલમ ૧..... (૨) વડે સરકાર પર જરૂરી ઠેરવવામાં આવ્યું છે કે તે કોઈ એવો કાનુન નથી બનાવી શકતી જે નાથી બંધારણના ત્રીજા પ્રકરણમાં આવેલા બુનિયાદી હકોમાંથી કોઈના હક્કને હાનિ પહોંચતી હોય. માર્ગદર્શક સિદ્ધાંતો માટે આવી કોઈ જોગવાઈ નથી.

**સારાંશ કે બંધારણની રૂએ માર્ગદર્શક સિદ્ધાંતો બુનિયાદી**

હકોની તુલનામાં કમજોર છે, એટલે બુનિયાદી હકોના વિરુદ્ધમાં એને થોપી પણ શકાય નહીં. સુપ્રિમ કોર્ટના અગાઉના ફેસલાઓ જેને અમે ઉપર ટાંકી ચૂક્યા છીએ તેનાથી પણ આ વાતને જ પુષ્ટી મળે છે. અને બંધારણ ઘડતી વેળા બુનિયાદી હકોને કાયદા ઘડનારી કમીટી તથા અદાલતોની સત્તાથી પણ ઊંચો દરજજો આપવામાં આવ્યો છે, તે છતાં હવે કેટલાક સમયથી આ દસ્તિકોણ બદલાય રહ્યો છે અને એ એવું ઠસાવવામાં આવી રહ્યું છે કે માર્ગદર્શક સિદ્ધાંતોને બુનિયાદી હકોથી વધુ નહીં તો કમથી કમ બરાબરનું મહત્વ આપવું જોઈએ.

પરંતુ અમે મુસલમાનો તો ભુલ્યા નથી કે બંધારણના ઘડવૈયાઓએ બુનિયાદી હકોને ભારતીય બંધારણમાં એક આગળું સ્થાન અને બીજી બાબતોને ચાહે તે કેટલીય મહત્વની કેમ ન હોય અસ્થાયી સ્થાન આપ્યું હતું. આ બધી વાતો નજર સમક્ષ રાખી વિચારવું જોઈએ કે માર્ગદર્શક સિદ્ધાંતો ખાતર બુનિયાદી હકોની આહૃતિ કેમ કરી દઈ શકાય અને બુનિયાદી હક્ક પણ કેવો? જેને મુસલમાન પ્રાણ ઘારો સમજે છે.

### એક ચેતવણી.

જુના જમાનાથી આ વાત ચાલી આવી છે કે જ્યારે કોઈ ક્રૌમનો ચહેરો બગાડવો હોય અથવા તેનું અસ્તિત્વ ખતમ કરવું હોય તો...

(૧) સો પ્રથમ તેની માન્યતાઓ ઉપર ચોર બારણે હુમલાઓ કરવામાં આવે છે અને તેની નાની મોટી, મહત્વની હોય કે ન હોય, દરેક બાબતે વાંધો ઉઠાવીને એને હલકી અને હાસ્યસ્પદ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. એના માટે

ક્યારેક કલમ – કાગળ એટલે કે મીડીયા દ્વારા કામ લેવામાં આવે છે અને ક્યારેક સરકારી તંત્રને હાથો બનાવવામાં આવે છે અને ક્યારેક ન્યાયાલયો અને અદાલતોનો આશરો લેવામાં આવે છે.

(૨) ક્યારેક શિક્ષણના રસ્તે નબળી પાડવાની કોશિશ કરવામાં આવે છે, શિક્ષણની ખાસ વ્યવસ્થા નથી કરવામાં આવતી. ઉચ્ચ શિક્ષણની તકો ઘણી ઓછી આપવામાં આવે છે. સાથે જ શિક્ષણ મેળવ્યા પછી કોઈ સ્થાન આપવામાં આવતું નથી. સરકારની આ ઠંડી નિતીથી નિરાશ થઈ તે કૌમ શિક્ષણ તરફ કાંઈ લક્ષ આપતી નથી, પરિણામ સ્વરૂપ કૌમના બાળકો અને યુવાનો શિક્ષણથી કોરા રહી જાય છે. કોઈ પ્રગતિશીલ કૌમ અને સમાજ માટે ઉચ્ચ શિક્ષણ અતિ આવશ્યક બાબત છે, એના થકી જ દરેક સમાજ અને કૌમ શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૈદાનમાં નોંધ પાત્ર સેવાઓ આપે છે. આ જ હેતુએ મુસલમાનોને આ ક્ષેત્ર પાછળ રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે.

(૩) કૌમની ઉન્નતિમાં આર્થિક સદ્ગરતા અને રોજગારનો પણ અગ્રિમ હિસ્સો છે. સારી આર્થિક હાલત એક પ્રગતિશીલ કૌમનું ચિંહ છે. આર્થિક હાલત સારી હોય તો જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી શકાય છે. કૌમને નબળી પાડવા માટે આ હથિયાર પણ વાપરવામાં આવે છે. પ્રગતિ કરતી કૌમને આર્થિક પ્રશ્નોમાં ફસાવી તેની પ્રગતિ રોકી દેવામાં આવે છે. પરિણામ એ આવે છે કે તે હિવસો હિવસ નબળી પડતી જાય છે અને એક સમય એવો આવે છે કે તેની બધી જ શક્તિઓ આર્થિક

સમસ્યાઓના હલ પૂરતી જ સિમિત થઈ જાય છે અને જીવનના અન્ય ક્ષેત્રોમાં એનું યોગદાન નગણ્ય રહી જાય છે.

(૪) જો આવા પ્રપંચોનું ધાર્યું પરિણામ ન મળો તો સીધે સીધો ધર્મ ઉપર હુમલો કરવામાં આવે છે અને લગતાર ઉતારી પાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. જેથી તે કૌમ કંટાળીને ધર્મ પરિવર્તન કરવા ઉપર અથવા પોતાના ધર્મના રક્ષણ કાજે દેશ છોડવા ઉપર મજબુર થાય. આજે જે કંઈ ભારતમાં થઈ રહ્યું છે તે એક યોજનાબદ્ધ કાવત્રા અને કાયદેસરની સ્કીમ હેઠળ જ થઈ રહ્યું છે.

#### સમાન સિલ્વીલતમાં કોડ માટે સરકારી વલણ.

આજે આપણા દેશમાં સુધારણા માંગતી અને ધ્યાન માંગતી અનેક સમસ્યાઓ મોજૂદ છે. એવી સમસ્યાઓ જે દરેકને પરેશાન કરનારી છે અને એમાં સુધારા કે હલ કરવા વિશે કોઈને પણ વિરોધ નથી. બલકે તે બાબતો તરફ પુરતુ લક્ષ ન હોવાને લઈ આજે દેશ અંધાધુંધીનો શિકાર છે અને દિવસો દિવસ બરબાદી તરફ ધકેલાઈ રહ્યો છે. માટે એટલે એ બાબતોની સુધારણા તરફ તાકીદે ધ્યાન આપવાની જરૂરત છે. જેમ કે લાંચ રૂશ્વત, દેશમાં વધી રહેલ ગુનાહિતપ્રવૃત્તિઓ, ખુનામરકી, લુંટમાર, કાળાબજાર, દાણચોરી, જાહેર નજનતા અને અશ્વીલતા, સરકારી ખાતાઓમાં બ્યુરોકેસી અને નૌકરશાહી, આ બધી એવી બાબતો છે જેની તાકીદે સુધારણાની જરૂરત છે, આ બદીઓ દુર થવાથી થનાર ફાયદાઓ પુરા દેશની પ્રગતિ અને સફળતાની ગેરંટી આપે છે. આવા સંજોગોમાં દેશનું હિત ઈચ્છતો કોઈ પણ માણસ ઉપરોક્ત સમસ્યાઓના હલને જ

પ્રાથમિકતા આપશે. કોઈ પણ માણસ સમાન સિવિલ કોડના ખરડા કે કાયદા ઉપર સરકારની શક્તિ વેડફાવાની પરવાનગી આપશે નહીં.

પરંતુ એક મુદ્દતથી સરકાર સમાન સિવીલ કોડ માટે કટીબદ્ધ થઈ ચૂકી છે. અને એ માટે અત્યાર સુધી વિવિધ પગલાં ભરી ચૂકી છે. માર્ચ ૧૯૭૭માં બેંગલોરમાં સમાન સિવીલ કોડના વિષય પર ભાષણ આપતા લો કમીશનના ચેરમેન મીસ્ટર ગજેન્ડ ગડકરે કહ્યું હતું કે 'મુસ્લીમોએ સમાન સિવીલ કોડના સ્વીકાર માટે તૈયાર થઈ જવું જોઈએ, અગર તેઓ ખુશી સાથે સ્વીકાર ન કર્યો તો બળ વડે આ કાયદો લાગુ કરવામાં આવશે' અને ત્યાર પછી જ વિવિધ દિશાઓમાંથી સમાન સિવીલ કોડ માટે માંગણી શરૂ થઈ.

આ જ દિવસોમાં મુસ્લિમોએ આ ભયને પારખી એનો પ્રતિકાર કરવા માટે એક પ્લેટફાર્મ પર આવવાની કોશીશ કરી, જેના પરિણામ રૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સ્થાપના થઈ અને મુસ્લિમો તરફથી સમાન સિવીલ કોડવાળા વિચારનો દેશના ખુણો ખુણોથી જોરદાર પ્રતિકાર થયો. સમયની હવા પારખી રાજકીય મસ્કેહતો અને મુસ્લિમ મતની ખફગીના ડરે જેના પ્રત્યાધાતો ઈલેક્શનમાં પડવાનો ભય હતો, ત્યારના વડાપ્રધાન અને બીજા રાજકીય નેતાઓ તરફથી એવું કહેવામાં આવ્યું કે હુક્કુમત અત્યારે મુસ્લિમ પર્સનલ લોમાં ફેરફાર કરવાનો કોઈ વિચાર રાખતી નથી. જ્યાં સુધી કે મુસ્લિમો તરફથી એની માંગણી ન થાય.

સરકારની બદનિયતી એનાથી જ જાણી શકાય છે કે હર

વખતે પોતાના એલાનમાં એ વાત જરૂર કહેતી કે અગર મુસલમાનો તરફથી એની માંગણી કરવામાં આવી તો જરૂર પર્સનલ લોમાં ફેરફાર કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સરકાર પોતે આ ફેરફાર માટે બેચેન છે, અલભાત સમય અનુકૂળ ન હોવાને લઈ કોઈ મોટો ફેરફાર નથી કર્યો. દાટક વિષેનો ખરડો પણ પાર્લિમેન્ટમાં રજૂ કરીને પાછો લઈ લીધો, કેમકે એણે જાણી લીધું કે આ પગદું પણ કસમયનું છે.

### મુસ્લિમોની લાગણીનું ટિક્કા.

અગર સરકારને મુસ્લિમોની લાગણીઓનો એટલો બધો ખ્યાલ છે કે જો ગણનાપાત્ર સંખ્યા પણ મુસ્લીમ પર્સનલ લોમાં ફેરફારની માંગણી કરે તો સરકાર એ માંગણી પુરી કરશે.

આજે લગગભ ૭૦ વરસથી કૌમી હુલ્લડોના નામ પર મુસલમાનોની કટ્લે આમ થઈ રહી છે અને ભારત ભરના બધા મુસ્લિમો આ સિલસિલાને રોકવા માટે એકમતે માંગણી કરી રહ્યા છે, પરંતુ આ ૭૦ વર્ષોમાં કરોડો રૂપિયાની મિલકતો તબાહ થઈ ગઈ, હજારો વ્યક્તિઓ પુરી પાશવતા સાથે જુબેહ કરી નાખવામાં આવી, જલાવી નાખવામાં આવી, સણગતી આગમાં જીવંતા બાળકોને ફેંકવામાં આવ્યા, પરંતુ સરકારનું રૂંવાટુએ ન ફરક્યું અને મુસ્લીમોની આ સર્વમાન્ય માંગણીને એક દિવસ પણ ઠાવકાઈથી સાંભળવામાં ન આવી. આ જ સરકારો ઈદિરા ગાંધીથી લઈ આજ સુધી કેટલીયે વાર એનું એલાન કરી રહી છે અગર મુસલમાનોનો ગણનાપાત્ર વર્ગ મુસ્લિમ પર્સનલ લોમાં ફેરફારની માંગણી કરશે તો જરૂર ફેરફાર કરવામાં આવશે. આખર વાત શું છે ?

મુસ્લીમો જેની સર્વાનુમતે માંગણી કરે છે અને જાઈજ માંગણી કરે છે અને વારવાર કહે છે તો એને સાંભળવામાં પણ નથી આવતી અને જે કામ મુસલમાનોને કોઈ કિંમતે મંજૂર નથી તેને કરવા માટે તલપાપડ છે. વાત માત્ર એટલી જ છે કે કૌમવાદી તત્ત્વો જે વાતો ખુલ્લમ ખુલ્લી અને સરેઆમ કહે છે, કડવા અને હિલ હુઃખાવનારા શબ્દોમાં કહે છે, સત્તાવાળાઓ તેને મધુર શબ્દોમાં કહે છે. ધ્યેય અને લક્ષ્ય બન્નેવનું એક જ છે.

#### હિન્દુ કૌમવાદી તત્ત્વો સરકારની વારે.

મુસ્લિમ પર્સનલ લોમાં ફેરફાર કરવા બલકે તેને ખતમ કરવા માટે સરકાર એક મુદ્દથી બેચેન હોવા છતાં એણે પોતાની નીતિમાં ઉપર મુજબનું વલણ અપનાવી રાખ્યું હતું, સરકાર તરફથી કહેવાતું રહ્યું કે જ્યાં સુધી ખુદ મુસલમાનો તરફથી એમા ફેરફારની માંગણી નહી થાય ત્યાં સુધી અમો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવા માંગતા નથી. એટલે એ માટે એણે છાગલા અને હમીદ દલવાઈ જેવા કેટલાક જમીર ફરોશ મુસલમાનો તૈયાર પણ કરી રાખ્યા હતા. જેમના મોઢે પર્સનલ લોમાં ફેરફારની માંગણીઓ પણ કરાવી અને એમનું જુથ મોટું બનતું જાય અને મુસ્લિમોના એક મોટા વર્ગમાં તેમની ચાહના મળે એ માટે પણ સત્તાવાળાઓ એ અંદરખાને વિવિધ યુક્તિઓ અજમાવી જોયી. પરંતુ સત્તાનું આ પીઠબળ પણ તેઓને મુસ્લિમ સમાજમાં કોઈ સ્થાન અપાવી શક્યું નહી. બલકે દરેક મુસ્લિમ ચાહે તે ભણેલો હોય કે અભણા, એવાઓને હડધૂત જ કરતો રહ્યો.

સત્તા પક્ષની આ પોલીસી ત્યાં સુધી જ રહી જ્યાં સુધી એને

મુસ્લિમ મતોની જરૂરત હતી. અને હવે જ્યારથી હાલની સરકારે સત્તાના સુત્રો સંભાળ્યા છે, ત્યારથી મુસ્લિમ વિરોધી માનસ ધરાવતા અને મુસ્લિમનોને નષ્ટ કરવાના પ્રયત્નો કરી ચુકેલા બહુમતિ વર્ગના માણસોએ એમની રીત બદલી નાંખી છે.

આજ સુધીના અનુભવથી એમણે આ પાઠ ગ્રહણ કર્યો કે કોઈ બીજી રીતે મુસ્લિમોને નામશોષ કરવા શક્ય નથી, એટલે આપણે હવે પોતાની ટેકનીક બદલવાની જરૂરત છે. એ જ કારણોના લઈ ઘણી જ સમજદારી પૂર્વક એક યોજના ઘડી કાઢવામાં આવી. એટલે કે મુસ્લિમોને દેશ બહાર કે જાન – માલથી ખતમ કરવાની કોણિશ કરવા કરતાં એવી રીત અપનાવવી જોઈએ કે મુસ્લિમાન તરીકેનું એમનું અલગ અસ્તિત્વ નષ્ટ થઈ જાય અને તેઓ બહુમતી સમાજમાં ભળી જાય, અને બહુમતિ સમાજ જેવા જ રીત – રિવાજો અપનાવી લે. આ માટે વિવિધ ક્ષેત્રે આકમણ શરૂ કરવામાં આવ્યું.

સૌ પ્રથમ તો પોતે બહુમતીના એક ભાગ રૂપે શાશક પક્ષના પડખામાં રહેવું, જેથી શાશક પક્ષને એ હથ્યા ધરપત રહે કે એને મુસ્લિમ મતો નહી પણ મળે તો ગભરાવવાની જરૂર નથી, બલકે એના બદલે બહુમતીનું પીઠબળ સત્તાની કુરસી ટકાવી રાખવા માટે કાફી છે. અને એ રીતે શાસક પક્ષને પોતાની મરજી મુજબ ચલાવવો અને જે ધ્યેયો આજ સુધી શાશક પક્ષના વિરોધમાં રહી પ્રાપ્ત ન કરી શક્યા તે એના નેજા હેઠળ બહુ સરળતાથી મેળવી લેવા.

બીજી તરફ મુસ્લીમો વિરુદ્ધ માનસિક યુદ્ધ પણ ચાલુ કરવું, જેના થકી ધર્મ પ્રત્યેની એમની અડગ શ્રદ્ધાને ડગમગાવવામાં

આવે. ધાર્મિક માન્યતાઓ અને હુકમો વિશે લોકોના દિલોમાં શંકા – કુશંકાઓ ઉત્પન્ન કરવી. આ બધી યુક્તિ પ્રયુક્તિઓનો જ એક ભાગ આ પણ છે કે અદાલતોમાં મુસ્લીમોના ધાર્મિક પ્રતિકો અથવા કિયાઓ અને કર્મકાંડો વિરુદ્ધ રીટ અરજીઓ કરવામાં આવે.

કુર્અને મજૂદ, દાઢી, કુરબાની, અજાન તથા તલાક પામેલા મુસ્લિમ મહિલા એક્ટર વિગેરેના દાખલા નજર સમક્ષ છે અને નેશનલ પ્રેસ વડે (જેના ઉપર સંપૂર્ણ હિંદુવાદી તત્વોને ઈજારો છે) પ્રચાર પસારનો એવો મારો ચલાવવો જેથી બહુમતીની એક એક વ્યક્તિત્વનું માનસ સંપૂર્ણ હિંદુવાદી અને મુસ્લીમ દુઃખન બનાવવાની સાથે સાથે પોતાના ધર્મથી અજ્ઞાશ એવા મુસ્લિમ વર્ગને પણ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડીયાના લેખો, સમાચારો, રિપોર્ટો, ચર્ચાઓ, ડિઝેટો, અને ઈન્ટરવ્યુઓ વગેરે થકી ઈસ્લામના બુનિયાદી સિધ્યાંતો તથા સામાજિક કાનૂનો વિષે શંકા કુશંકાના વમળમાં ફસાવવામાં આવે. અને એ રીતે મુસ્લિમાનોના અલગ વ્યક્તિત્વને ટકાવી રાખનાર 'પર્સનલ લો'ના એક માત્ર સામાજિક માળખાને સમાન સિવીલ કોડમાં ફેરવીને ભવિષ્યમાં મુસ્લિમોને બહુમતીના વહેણમાં વહાવી લેવાનો રસ્તો સરળ બનાવી દેવામાં આવે.

મુસ્લિમ વિરોધી પરીબળોના સત્તાધારી પક્ષ સાથેના ગઈજોડનું જ પરિણામ છે કે આજે તેઓને સંતોષિત કરવા માટે સમાન સિવીલ કોડનો ખરડો પાર્લિમેન્ટમાં રજૂ કરવા માટે સરકાર કટીબદ્ધ થઈ ચૂકી છે અને એ વિષે એણે કડક વલણ અપનાવી લીધું છે. ગઈ કાલ સુધી જે સરકાર એવું કહેતી આવી

છે કે મુસ્લીમોની મરજી વિરુદ્ધ અમે પર્સનલ લોમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી અને સમાન સિવીલ કોડ લાવવાનો હાલમાં અમારો કોઈ વિચાર નથી, તે જ સરકારના વડાપ્રધાને કાયદા પ્રધાનને સમાન સિવીલ કોડનો મુસદ્દો તૈયાર કરી પાર્ટીમેન્ટમાં રજૂ કરવાનો આદેશ આપી દીધો છે. જો કે અત્યારે એવું પણ કહેવામાં આવે છે કે આ કાયદો મરજીયાત હશે પરંતુ એ મરજીયાત કાયદાને ફરજીયાત બનતા વાર નથી લાગતી અને માની લ્યો કે મરજીયાત રૂપે એને પાસ કરવામાં આવે તો પણ તે એક રીતે ફરજીયાત બની જાય છે કારણ કે જ્યારે કુટુંબની બીજી વ્યક્તિ જે એના સામે પક્ષે છે તેના ઉપર આ કાયદો ફરજીયાત રૂપમાં હોય અને એ ખરડો આવતાં પહેલા જ એવી વાતો શરૂ થઈ ચૂકી છે.

ભારતભરના વકીલોની મોટામાં મોટી સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની સિલ્વર જ્યુબીલી સમારંભમાં બાર કાઉન્સીલના ચેરમેન વી.સી.મિશાએ તો ઘમકી પણ ઉચ્ચારી છે કે અગર જરૂરી લાગશે તો કૌમી એકતાના હિતમાં સમાન સિવીલ કોડની પ્રાપ્તી માટે આંતર વિગ્રહનો સામનો કરવા તૈયાર થઈશું. મિસ્ટર મિશાના આ ભાષણ વખતે વડાપ્રધાન અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ મવજુદ હતા, બલકે આ સમારંભના પૂર્ણાહૃતી ભાષણમાં ગૃહભાતાના રાજ્ય પ્રધાને ફરજીયાત સિવીલ કોડની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે એક વકીલ તરીકે મરજીયાત સમાન સિવીલ કોડની પરીભાષા મારી સમજમાં આવતી નથી.

(મુણ આ પુસ્તિકા ૧૯૮૬ માં લખવામાં આવી હતી, આ

બધી તે વેળાની ઘટનાઓ છે. તે વેળા મુસલમાનો તરફથી ભારે વિરોધ થવાના કારણો સરકારે ખરડો પાછો ખેંચી લીધો હતો. આજે ૨૦૧૬માં પણ સિથિત કુંઈક અંશો એવી જ છે. ફરક એટલો છે કે પહેલાં સિવિલ કોડની હિમાયત સરકાર તરફથી આવતી હતી. આ વખતે સુપ્રિમ કોર્ટ તરફથી એની મર્યાદા ઓળંગીને સરકાર પાસે ત્રણ તલાકની પ્રથા ખતમ કરવા અને સમાન નાગરિક ધારા વિશે અભિપ્રાય માંગવામાં આવ્યો. અને એક લોકશાહી સરકાર તરફથી પોતાની પ્રજા એટલે કે મુસલમાનોનું મંતવ્ય પૂછ્યા વગર જ ત્રણ તલાક, બહુવિવાહ વગરે ખતમ કરવા અને સમાન સિવિલ કોડ વિશે હકારાત્મક અભિગમ હોવાનું સોંગંદનામું દાખલ કરવામાં આવ્યું. એટલે કે સમાન સિવિલ કોડનું ટીકુરું આ વેળા સુપ્રિમ કોર્ટના માથે ફોડવાની વાત છે.)

આ ટાણે મુસ્લિમોએ સમાન સિવીલ કોડના ભય સ્થાનો શું છે તે વેળાસર જાણીને એના પ્રતિકાર માટે કટીબજ્જ થઈ જવું જોઈએ. જો આજે મુસ્લિમો એ તરફ બેઠરકારી બતાવશે અને પોતાની ગફલતની ઉઘમાંથી જાગૃત નહી થાય તો એમની આવતી પેઢીને બહુમતીમાં ભળી જવાથી કોઈ બચાવી શકે નહી. અને એ રીતે દેશમાંથી મુસ્લિમોને નામશેષ કરવા માટે કોશીશ કરનારા પરીબળો એક મુદ્દતથી જે સ્વખ જોઈ રહ્યા છે એ વાસ્તવિકતાનું રૂપ ધારણ કરી લેશો.

મુસલમાનો આ દેશમાં તેમના ઉપર હજારો કયામતો આવવા છતાં છતાં માત્ર એટલા ખાતર સંતોષિત હતા કે ભારતનું બંધારણ બિન સાંપ્રદાયિક સિદ્ધાંતો ઉપર આધારિત છે

અને તે દેશના રહેવાસીઓને પોતાના ધર્મ પ્રમાણે જીવન ગુજરવાની પુરેપુરી સ્વતંત્રતા પ્રાપ્ત છે અને બંધારણામાં એવી ગેરંટી અપાયેલી છે કે સરકાર કોઈ પણ ધર્મના અનુયાયીઓના પર્સનલ લોમાં કોઈ દખલગીરી નહીં કરે. પરંતુ હવાનું રૂખ બતાવી રહ્યું છે કે, બંધારણે આપેલી આ ગેરંટી પોકળ થઈને રહેશે.

### હવે આપણે શું કરવું જોઈએ ?

મુસલમાન અગર જીવંત રહેશે તો ઈસ્લામી સિદ્ધાંતોની સાથે જીવંત રહેશે અને જો એ સિદ્ધાંતોને છોડીને જીવન ગુજરવા પર મજબુર થયો તો એના જીવન કરતા એનું મૃત્યુ બહેતર છે.

આજના સમયે સૌ પ્રથમ તો એ જરૂરી છે કે આ દેશમાં વસતા બધા જ મુસલમાનો અદગ નિશ્ચય કરી લે કે આપણે આ સંજોગોનો પ્રતિકાર કરવાનો છે. એના માટે આપસની એકતા સંગઠન અને સંઘબળ બહુ જ જરૂરી છે. માટે સૌ પ્રથમ આપસના મતભેદો ભુલી જઈ એક પ્લેટફાર્મ ઉપર આવવાની કોશિશ કરે અને એક લોકશાહી દેશમાં લોકશાહી રીતો આપનાવી એનો મુકાબલો કરે.

આપણે સભાઓ યોજવા, સરધસો કાઢવા અને સુતો પુકારવાને જ કાફી સમજી રહ્યા છીએ અને એવું સમજીએ છીએ કે વિરાટ સભાઓમાં જોશીલા ભાષણો વડે સરકાર વિરુદ્ધ પોતાની લાગણીઓ દર્શાવવાથી આપણા પ્રશ્નો ઉકલી જરૂર અને આપણે ધર્મના રક્ષણાની જવાબદારીના બોજથી હલકા થઈ જઈશું. આ વિચારશૈલી ગેર લાભદાયક હોવાની સાથે મિલ્લતના અસ્તિત્વ માટે ભયજનક પણ બની શકે છે. માટે

ફક્ત આટલું કાફી નથી. સરકારને બતાવવાની જરૂરત છે કે અમે અમારા પ્રશ્નો આવી કોઈ બિનઈસલામી પ્રણાલીને હવાલે નહીં કરીએ.

અગત્યની વાત તો એ છે કે આપણે ગુંચવાયેલા પ્રશ્નો વિષે ઉતાવળીયા વિચારોથી કામ લેવા ટેવાઈ ગયેલા છીએ. કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થવાની બુનિયાદ શું છે ? તે ક્ષતિને દૂર કરવા તરફ આપણે ઘણું જ ઓછું ધ્યાન આપીએ છીએ.

આપણે એ ભુલવું ન જોઈએ કે કોઈ પણ કૌમની ચડતી પડતી એમની પોતાની ચાલ – ચલગત અને આચરણ ઉપર અવલંબીત હોય છે. જ્યાં સુધી કોઈ સમાજ અને કોમ પોતે પોતાની તબાહીનો સામાન ન પેઢા કરે, કોઈ પણ સત્તા કોઈ કૌમને નષ્ટ નથી કરી શકતી.

કેટલા અફસોસની વાત છે કે આજે આપણે પોતાની જુંદગીઓને નથી જોતા કે આપણે પોતે દરરોજ કેટલા ઈસ્લામી આદેશોનું ઉલ્લંઘન કરીએ છીએ ? આપણે પોતે પોતાને અને સમાજને કેટલા બગાડી રહ્યા છીએ ? આપણા અંદર ડગલે ને પગલે ખરાબીઓ મવજૂદ છે.

જરૂરત એની છે કે આપણે બીજાને કશું કહેવાને બદલે પહેલાં પોતાના ઘરની ખખર લેઈએ. પોતાને સુધારીએ. સમાજને સહીહ લાઈન ઉપર લાવવાની કોશીશ કરીએ, અને પછી પુરા વિશ્વાસ અને અડગ શ્રીદ્વાની સાથે તે લોકો સાથે વાતચીત કરીએ જેઓ આપણા અમૃત્ય દીન અને ધર્મમાં દખલગીરી કરી રહ્યા છે. અને પોતાના ઉચ્ચ સંસ્કારથી અને દઢ આચરણથી એમનું મોહું બંધ કરી દઈએ.

જરૂરત છે કે આજે 'મુસ્લિમ કૌમ પર્સનલ લો'ના વિષયે પૈદા થયેલી જગૃતિથી ફાયદો ઉઠાવીને સમાજ સુધારણાની ચળવળ શરૂ કરી હે. આ જોશ – ખરોશને નકારતમક દિશાથી હટાવી હકારતમક દિશામાં લગાવવામાં આવે. અને શહેર – શહેર, ગામડે-ગામડે દરેક મુસ્લિમ ઘરમાં ઈસ્લામી કેળવણીને સહીઈ રૂપમાં રજુ કરવામાં આવે. તેમાં રહેલા ભલાઈના પાસાઓને ઉપસાવવામાં આવે અને દરેક વ્યક્તિને તૈયાર કરવામાં આવે કે તે આજથી પોતાનું જીવન ઈસ્લામી હિદાયત પ્રમાણે વિતાવશે. અગર આપણે આ કામ કર્યું તો હું સંપૂર્ણ વિશ્વાસની સાથે કહું છું કે આ લોકો જેઓ આજે ઈસ્લામ અને કુર્અનના દુષ્મન છે તેઓ કાલે ઈસ્લામ સ્વીકારવા પર મજબૂર થશે.

આપણે યાદ રાખવું જોઈએ કે આપણો રક્ષક માત્ર અલ્લાહ જ છે. એના જ હાથમાં આપણી ઈજાત અને જિત્તત છે. ટુંકા ગાળા માટે સત્તાની ખુરશી પર બિરાજમાન થયેલાઓ સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી આપણે કયારેય સંતોષિત નથી થઈ શકતા. અગર તેઓ આપણાથી ખુશ પણ થઈ ગયા અને આપણી માંગણીઓને માન્ય પણ રાખી લીધી, પરંતુ આપણે પોતાના સમાજને ઈસ્લામી બીબામાં ટાળી ન શક્યા તો શું આપણાને મળેલો આ સત્તાનો ટેકો આપણા માટે ફળાયી પુરવાર થશે? અલ્લાહ તથાલા અને એના રસૂલ (સલ.) તરફથી આપણા ઉપર લાદવામાં આવેલી જવાબદારી ખતમ થઈ જશે? સ્પષ્ટ છે કે આનો ઉત્તર નકારમાં હશે. તો પછી આપણે આપણી બધી જ શક્તિ સરકારથી ટકકર લેવામાં શા

માટે ખર્ચ કરી નાખીએ ?

સરકારને પોતાના દ્રષ્ટિકોણથી વાકેફ કર્યા પછી (અને રૂપદ્ધ શબ્દોમાં એવું જણાવી આપ્યા પછી કે અમે કોઈ પણ હાલતમાં પોતાના દિવ્ય—કુર્ચાન અને દીનની તા'લીમથી હાથ ઉઠાવી શકતા નથી. ચાહે એ માટે અમારે મોટામાં મોટી કુર્ચાની કેમ ન આપવી પડે) આપણે પોતાનું રૂખ પોતાના ભાઈઓની સુધારણા તરફ કેમ ન કરવું ?

અગર આપણે પોતાની શરીરાતનું રક્ષણ ન કર્યું, પોતાની ઈજાત અને આબરુની હિફાજતની પોતે ફિકર ન કરી તો પછી બીજાઓ પાસે શરીરાત, ઈજાત અને આબરુની હિફાજતની માંગણી કરવાનો કોઈ અર્થ નથી.